

ટોરોન્ટો પબ્લિક હેલ્થ

સંપર્કની ભાળ મેળવવામાં હંગામી ફેરફાર

ટોરોન્ટોમાં કોવિડ-19 કેસોની ઉંચી સંખ્યાનાં કારણે, ટોરોન્ટો પબ્લિક હેલ્થ (TPH) દ્વારા જે રીતે અમે સંપર્કની ભાળ મેળવીએ છીએ તેમાં હંગામી ફેરફાર કર્યો છે. સૌથી ઉંચી જોખમની પરિસ્થિતિઓ પર અમારા પ્રયાસો કેન્દ્રિત કરી રહ્યા છીએ. આનો અર્થ એવા લોકો જેઓને કોવિડ-19 હોય અને જેઓનો ચેપ અન્ય લોકોને સૌથી વધુ જોખમકારક હોય.

હાલ પૂરતું, **TPH** એવા લોકોનો સંપર્ક કરશે જેઓને કોવિડ-19 નું નિદાન થયું હોય જે આ માટે છે:

- તેઓનાં પોઝિટિવ કોવિડ-19 લેબોરેટરી તપાસનાં પરિણામોની પુષ્ટિ કરવા.
- તેઓનાં લક્ષણોની આકારણી કરવા, અને તેઓ ક્યારે શરૂ થયા હતા તે નક્કી કરવા.
- સુરક્ષિત રીતે સેલ્ફ-આઇસોલેટ થવાની તેઓની ક્ષમતાની પુષ્ટિ કરવા અથવા તેઓને ટોરોન્ટો વોલન્ટરરી આઇસોલેશન સેન્ટર પર રેફર કરવા.
- તેઓનાં ઉંચા-જોખમ પર રહેલા સંપર્કોને તેઓ કેવી રીતે સૂચિત કરી શકે તેનાં પર સૂચનાઓ પ્રદાન કરવા.

કોવિડ-19 નું નિદાન થયું હોય તેવા લોકોને તેઓનાં લક્ષણો શરૂ થયા પહેલા 14 દિવસોમાં તેઓનાં નિકટનાં સંપર્કોમાં આવેલા લોકોની સંખ્યાની ઓળખ કરવા માટે TPH દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નિકટનો સંપર્ક એટલે એવી કોઈપણ વ્યક્તિ જે તેઓનાં પરિવારનો ભાગ ન હોય અને તેની સાથે કોઈપણ ઘનડોર સામાજિક મેળાવડામાં અથવા ભીડવાળી ઘનડોર જગ્યામાં તેઓએ 15 મિનીટ કરતા વધારે સમય પસાર કર્યો હોય. આ માહિતી TPH ને સંપર્કનાં વ્યવસ્થાપનમાં અને અનુસરણમાં મદદરૂપ થવા માટે 10 અથવા વધારે ઉંચા-જોખમ પર રહેલા લોકો ધરાવતા વ્યક્તિની ઓળખ કરવામાં મદદ કરશે. આપણા શહેરમાં કોવિડ-19 નો ફેલાવો ઘટાડવામાં મદદરૂપ થવા માટે લોકોને કેવી રીતે ચેપ લાગ્યો હતો તેનાં પર માહિતી એકત્રિત કરવા માટે TPH દ્વારા ઓનલાઇન સર્વેનો પણ ઉપયોગ કરવામાં આવશે. TPH દ્વારા હોસ્પિટલોમાં, લાંબા-ગાળાનાં સંભાળ ઘરોમાં, નિવૃત્તિ ઘરોમાં, શાળાઓમાં અને બાળ સંભાળ ગોઠવણોમાં ફેલાવાની તપાસણી અને પ્રતિભાવ આપવાનું સતત ચાલું છે.

જ્યારે ટોરોન્ટોમાં કોવિડ-19 કેસોની સંખ્યા વ્યવસ્થાપન થઈ શકે તેવા સ્તર પર પરત ફરશે, ત્યારે TPH દ્વારા તેની નિયમિત સંપર્કની ભાળ મેળવવાની પ્રક્રિયા ફરીથી ચાલું કરવામાં આવશે.

19 નવેમ્બર, 2020